

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી (સર્ટીફાઈડ/ ટ્રુથફુલ) બિયારણના વેચાણ બાબત

આથી ખેડૂતોને જાણવાવાનું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૨ ઋતુમાં વાવેતર માટે મગફળી જીજી-૨૦, જીજીજી-૨૨ અને જીજીજી-૩૨ જાતોના સર્ટીફાઈડ/ટ્રુથફુલ (વિપ્રવાસપાત્ર) બિયારણ ખરીદી માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ. તે અરજીઓના કોમ્પ્યુટરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન સીસ્ટમથી રેન્ડમાઈઝેશન બાદ પસંદગી પામેલ ખેડૂતોને આ સાથે નીચે જણાવેલ શરતોના ચુસ્તપણે પાલન કરવાની શરતે આપવાનું થાય છે. બિયારણના ભાવની વિગતો નીચે કોષ્ટકમાં જણાવેલ છે. વધુ માહિતી માટે સીડ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન નં.૦૨૮૫-૨૬૭૫૦૭૦ તથા ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૮૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો.

પાક અને જાતનું નામ	બિયારણની કક્ષા	સબસીડી સહાય વિનાનો ભાવ	સબસીડી સહાય સાથેનો ભાવ
મગફળી (જીજીજી-૨૨)	સર્ટીફાઈડ	રૂ.૩૨૬૦/- પ્રતિ બેગ (૩૦ કિલો)	રૂ.૨૦૬૦/- પ્રતિ બેગ (૩૦ કિલો)
મગફળી (જીજીજી-૩૨)	સર્ટીફાઈડ	રૂ.૩૨૬૦/- પ્રતિ બેગ (૩૦ કિલો)	રૂ.૨૦૬૦/- પ્રતિ બેગ (૩૦ કિલો)
મગફળી (જીજી-૨૦) (જીજીજી-૨૨) (જીજીજી-૩૨)	ટ્રુથફુલ	રૂ.૨૦૬૦/- પ્રતિ બેગ (૩૦ કિલો)	સબસીડી સહાય નથી

વેચાણનો સમય :- સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ તથા બપોરના ૩:૦૦ થી ૫:૩૦

વેચાણનું સ્થળ :- સીડ હબ ગોડાઉન, ગેટ નંબર-૩ ની પાસે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

નોંધ :- ઓનલાઈનન અરજીની નોંધણી થયા બાદ નીકળેલ પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરી તેને બિયારણ લેવા આવો ત્યારે જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નં. અને બેંકનો IFSC નંબર વંચાય તેવો હોવો જોઈએ) અરજીની પહોંચ સાથે રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

“ગીર સાવજ” મગફળી (સર્ટીફાઈડ/ ટ્રુથફુલ) બિયારણના મેળવવા માટેની શરતો

- ખેડૂતોએ બિયારણ ખરીદી માટે જૂનાગઢ ખાતે લેવા આવવાનું રહેશે.
- જો કોઈ ખેડૂત અરજદારની માહિતી ખોટી/ અપુરતી/ ઘટતી જણાશે તો તેવા અરજદારની અરજી રદ થશે.
- માન્ય અરજવાળા ખેડૂત અરજદારભાઈઓને બિયારણ કઈ તારીખે લેવા આવવું તેની માહિતી આપના દ્વારા અરજીમાં નોંધવામાં આવેલ મોબાઈલ નંબર પર SMS થી જાણ કરવામાં આવશે.
- બિયારણ ખરીદી માટે અરજદારને જાણવવામાં આવેલ તારીખે જ બિયારણ મળશે. એટલે કે અરજદારને જે તારીખે બિયારણ લેવા આવવા માટે જાણવવામાં આવેલ હોય તે તારીખે એજ લઈ જવાનું રહેશે. જાણવવામાં આવેલ તારીખે એજ ખેડૂત બિયારણ ખરીદવા નહિ આવે તો તેનો દાવો રદ ગણવામાં આવશે અને ત્યારબાદ યાદી મુજબ ક્રમમાં આવતાં અન્ય ખેડૂતને તેનો લાભ મળશે.
- મગફળીની જાતો જીજી-૨૦ જીજીજી-૨૨ અને જીજીજી-૨૨ પૈકી કોઈપણ એક જાતનું બિયારણ જે ખેડૂતની અરજી મંજૂર થઈ છે તેઓને જ્યારે તેમનો વારો આવે ત્યારે હાજર સ્ટોકમાં હશે તે મુજબ અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (૩૦૦ કિ.ગ્રા. ડોડવા) સુધી મળવાપાત્ર થશે. (બે હેક્ટરની મર્યાદા એટલે કે મગફળીમાં ૨૦ ગુંડા જમીને એક બેગ અને તે મુજબ ૨૦ ગુંડાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય.)
- હાલમાં દેશમાં ફેલાયેલ COVID-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રોની અરજી મંજૂર થાય અને તેઓ બિયારણ લેવા માટે આવે ત્યારે જે તે સમયે ગુજરાત સરકારશ્રીની સોસલ ડીસ્ટન્સ, માર્સ્ક પહેરવું, સેનીટાઈઝેશન તેમજ COVID-19 સંદર્ભેની તમામ માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.